

## STATEMENT

સ્ટેમેન્ટ

હેશપરહેશના વિદ્વાનો અને વિવેચકોએ

મહાકાવ્ય કાલિકાસને ભારતના રાજ્યકાવ્ય તરીકે વિરદ્ધ વ્યા.  
 છ. શ્રી અરવંહેં તેમની ગણિના મહાર્ષિ વાલ્મીકિ અને વ્યાસ  
 સાથે કરી છે. દોઢેક હજર વર્ષ થઈ ગયું હોવા છતાં તેમની  
 મોહિની, પુરાતન છતાં નિત્ય નવીન રહી છે. તેમણે  
 ભારત અને માત્રવના હૃદયના જનાતન ભાવોને પોતાની  
 કાવ્યવિશ્વાસ પર રણગ્રણ વ્યા છે, તેથી જ પ્રાચીન હોવા છતાં  
 તેમની કૃતિઓ નિત્યનુતન લગે છે. ઠ. ર. ૧૮મિ સદીના.  
 અંત ભાગમાં સરવિવિદ્યમ બેન્કે તેમની અમૃતકૃત શાસ્કૃતલના.  
 અનુવાદ દ્વારા તેમનો અને ભારતીય સંસ્કૃતનો પરિવિદ્ય  
 પરિચયમના જગતને કરાવ્યો ત્યારથી ત્યાં પણ તેમની ઐવી જ  
 પ્રશ્નાશ ત્યાંના ઉચ્ચક્ષાના કવિઓ, કાવ્યરસેકો અને  
 લદવાનો દ્વારા થતી જ રહી છે. જગતની દરેક મહાસ્વની  
 ભાષામાં તેમની એક કે વધારે કૃતિઓના એક કે વધારે  
 અનુવાદો થયું છે.

ભારતમાં અગ્રેના સંપર્કને પરિણામે નવાચુગનાં  
 મંડપાં થયાં તે પહેલાં તેમની કૃતિઓનો અન્યાસ વિદ્વાનોના  
 નાનકડા વર્ગ પૂરતો મય્યાદિત હતો. ચુનિવર્સીટીઓની  
 સ્થાપના થતાં અગ્રેલ, સંસ્કૃત, ગુજરાતી અને ફારસી ભાષા-  
 સાહિત્યનો નવી પર્દ્ધિતણે વ્યાપક પ્રમાણમાં અસ્યાસ થવા  
 લાગ્યો, દેશમાં નવાજગ્રંથ, સુધારો અને રાષ્ટ્રીયતાની  
 સાંબના વક્સવા લાગ્યા. તે દેશાભમાનનો કાળ હતો. દુનિયાની  
 પરિચયમાં મહાકાવ્ય કાલિકાસની છણી અને માત્રખૃતી કરાવાની  
 પેદા થયું. શે. મુખ્યતાના ચુગમાં જે કંઈ કરું હોય તે

ખોતાની ભાષામાં રજુ કરવાની મનોવૃત્તિ નવા ગ્રેજ્યુએટો  
અને વિદ્વાનોસાં ધ્યાની હતી. તેથી, જેમ લારતની અન્ય  
પ્રતીય ભાષાઓમાં, તેમ ગુજરાતીમાં પગ સંસ્કૃત ભાષાની -  
કાલદાસની પગ કૃતિઓના અનુવાદો મોટો સંપ્રચામાં થવ।  
લાગ્યા, હજ પગ થયે જાય છે. તેમાંના કેટલાક તો રોશેક  
વર્ષ પહેલાના છે. કેટલાક અપ્રાપ્ય છે. વા સુલાઇ ગયા છે.  
તે દરેક કૃતિના અનુવાદોનો સમય નુંક્રમે, સાંહિત્યક અને  
તુલના ત્મકું હૃદયાચ અભ્યાસ ભાગ્યા જ થયો છે. કબ. આચાર્ય  
આનિદ્ધેકર દુંગ, શ્રી ડૉબ્રરરાય મંકિંદી, શ્રી રસિકલાલ  
પરીણ જેવા વિદ્વાનોણે થોડા અનુવાદોની તુલના કરી છે,  
પગ બધા અનુવાદોને સ્વીતમાં રાખીને સમય નુંક્રમે અભ્યાસ.  
કરવાનો પ્રયત્ન થયો નથો. આ મહાનિવેદ તે બધાનો તેવો  
અભ્યાસ કરવાનો પ્રયત્ન છે.

તેમાં નીચેની બાબતો પહેલી જ વાત રજુ કરવામાં  
અછી છે. તેમ આ અભ્યાસકંઈ નામ વાક્તવ્ય છે.

: ૧: દરેક કૃતિના પ્રાપ્ત થયેલા અનુવાદોનો સમય નુંક્રમે  
મનુઃપ્રસર્થ અભ્યાસ કરી, સાંહિત્યની હૃદયાને તેનું સુલાઇ કેટલું,  
કાલદાસ જેવા મહાસમર્થ, "મરમી" કવની કૃતિઓને સંસ્કૃત  
જેવી વિકલ્પત ભાષામાંથી ગુજરાતીમાં રજુ કરવામાં તેમને  
કેવો - કેટલી સફળતા મળી છે, તેમને જ્યાં જ્યાં મુંગવણો નહીં  
છે, સુજાથી જ્યાં અને કેવી રીતે તે જુદા પડે છે, ચુક્ષમ ભાવોને  
વ્યક્ત કરવામાં અર્થસંદર્ભો ક્ષેત્ર ન થયા હોવાને કારણે કેવી -  
મુશ્કેલી ઊસ્તિ થાય છે, કાલદાસના ભાવ અને જીવન દર્શાને  
સમજવાના અને રજુ કરવાના પ્રયત્નમાં તેમને કેવી સફળતા  
મળી છે - તેનો વચા: કરતો જા પ્રથમ પ્રયત્ન છે -  
કાલદાસના full import અનુવાદ કરી શક્ત ગતાવી છે તેનો  
અનુવાદ આ અનુવાદકોણે કેવી શક્ત ગતાવી છે.

: २: इ. १४० सुधीना समयमां भण्डकवि कालिकासनी  
हृतिशोना के अनुवादों थथा है, ते ते जमानाना विद्वानों  
में सात्त्वित्यक्षिकोनो अभिनवेश सुचवे हैं। तेमनो उत्साह  
पूर्ण रूप है। शब्दकृतनो अस्यासु वद्यो हैं, मैंने अपशु प्रसवृत्ते  
तथा औचित्ययुक्ति धड़तां गयां हैं एवं तेमनी उपो  
वातालवान्तु सहज हैं, पशु पश्चिना अनुवादकोने पुरोगम्भीरोना  
प्रयत्नोनो लाभ माल्यो हैं, ते तेमना अस्ति उपर उसां रहीने  
भोटा देखाय हैं ते न्यानमां राघवान्तु हैं।

: ३: आ। अस्यासमां, नामुसंहार, भैरवीहृत, हुमारसंभव,  
रधुवंश, मालविकासिनभिन्न, विक्रमोर्वशी, शास्त्रज्ञानशकुन्तल -  
ए सातेय हृतिशोना अनुवादों अस्यास क्यों हैं: ते नीचे

कुछाण:

: १:	ग्रहुर्विहार	६
: २:	भैरवीहृत	२१
: ३:	हुमारसंभव	४
: ४:	रधुवंश	८
: ५:	मालविकासिनभिन्न	४
: ६:	विक्रमोर्वशी	५
: ७:	शकुन्तल	१४

आ। गणनामां ऐक अनुवादनी ऐकानि वधारे उत्तृसंस्कृत भाषी।  
होय तेनी गणना करी नभी।

: ४: इ. १४०० पहेलाना धृता अनुवादों आजे अप्राप्य  
है, लुकाहि गयां हैं, के गायंगांठयां पुस्तकालयोमां होय, तो  
तेनां पानां अरड थां जवाने के फाटी जवाने कारणे २६  
करेला है। वहु थोडा विद्वानोने तेनो अस्ति तोवा संभव  
है। ते वहु काजना गर्नमां हुप्त थह अय ते पहेलां तेनु  
मूल्यांकन के परिवर्त्य कराववानी है तथा अनुवादोमध्ये  
विस्तृत उतारा जापीने, तेना ज्वारस्यनो विचार करीने,  
तेमनी विशेषता तथा भयद्वा दर्शववानो प्रयत्न क्यों हैं।

તે પ્રગટ થયા હણે તે વાખતે તેમને વિચાર થયો હોય  
તો પણ તે સુલાઈ ગયા કેવો છે.

: ૫: અનુવાદકોને નહેલી મુજવણો તથા તેમની મથામગો,  
તેમના જનાનાની સર્વીદાળો, અમૃત ભાવને વ્યક્ત કરવા માટે  
જુણુક યોગ્ય પર્યાયના રિપ્યોગમાં નિર્દિશતતાને અભાવે તેમને  
ઝાંધેલી ઠોકરો, અપૂર્ણ સમજ કે ગેરાયાજને પરિણમે થયેન્ના  
વપર્યાયનો પણ ચથુંભવ વિચાર કર્યો છે.

: ૬: અનુગામિઓનું કાર્ય, પુરોગામિઓનો લાભ  
મળવાને કરશે ધ્યાન સાંદું હોય - એ પણ નિરપવાદ સત્ય  
નથી. ક્રીંકલાભાર્થના કે નાનાલાલના મેધાવુતના અનુવાદપરથી  
આ કેટા શકાય હૈ.

જીમ મહાકાવ કાલદાસની કૃતિઓના ગુજરાતી  
અનુવાદોના આસાનવેશયુક્ત પ્રચારનો સમયાનુક્રમે વિચાર  
શહીં પહેલી વાખત થાય છે.

: ૭: પરિશિષ્ટો :

: ૧: કાલદાસના ઉલ્લેખો અને શેજાલે

: ૨: ગ્રંથસૂચિ

: ૩: ગુજરાતીમાં લાયેલા કાલદાસ  
વિષયક છેઓની ચાઢી

શાલી યાદી મેં ગુજરાતીમાં પહેલી જ  
વાખત રંગ કરી છે.